

78 78 5 91 0 92 પર GK લખી વોટ્સેપ પર સેન્ડ કરો.

Current affairs 42 (2) સામાન્ય જ્ઞાન 1-4-2017

Page-1

## રાષ્ટ્રીય

- ૧) ભારતના દિલ્લી ખાતે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર સંસ્થા ખાતે એગ્રિ વિઝન 2017 નું આયોજન કરવામાં આવેલ છે.
- ૨) ઉસ્તાદ અમઝદ અલીખાને ભારતના 12 સંગીતકારો પર માસ્ટર ઓન માસ્ટર્સ નામની બુક લખેલ છે.
- ૩) ગુજરાતના સુરત ખાતે દેશના વડાપ્રધાનશ્રી આગામી 17 એપ્રિલ 2017 ના રોજ સુમુલ ડેરીના 400 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
- ૪) વેસ્ટર્ન રેલ્વે દ્વારા તૈયાર કરાયેલ વર્ષ 2017 નું નવું સમય પત્રક 1 જુલાઈ 2017 ના બદલે 1 ઓક્ટોબર 2017 ના રોજ અમલી બનાવવામાં આવશે.

## આંતરરાષ્ટ્રીય

- ૫) અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાંકા વ્હાઈટ હાઉસમાં પોતાના પિતાના સલાહકાર તરીકે કાર્ય કરશે.
- ૬) સોવિયેટ સ્પેસ મિશનની સ્થાપના વર્ષ 1931 માં કરવામાં આવી છે, તેના દ્વારા અંતરીક્ષમાં પ્રથમ ઉપગ્રહ, પ્રથમ પ્રાણી તથા પ્રથમ માણસ મોકલવાનો રેકોર્ડ કરાયેલ છે.
- ૭) 31 માર્ચ 1966 ના રોજ સોવિયેટ સંઘે ચંદ્રચાન લુના-10 લોન્ચ કર્યું હતું.
- ૮) મંગળ ઓર્બિટર મિશને લાલ ગ્રહ પર સુપર હોટ ઓર્ગનની પ્રમુખ શોધ કરેલ છે.
- ૯) ઈઝરાયેલ દેશે ભેદભાવને કારણે સચુંકત રાષ્ટ્રમાં પોતાનું યોગદાન ઘટાડી દીધેલ છે.
- ૧૦) મધ્ય અમેરિકાનું સૌથી નાનું રાષ્ટ્ર એલ.સાલ્વાડોર ઘાતુ ખનન પર પ્રતિબંધ લગાવનાર પ્રથમ દેશ બનેલ છે.

1-4-2017

**રમત-જગત**

- ૧૧) ભારતીય બેડમિન્ટન ખેલાડી સમીર વર્માએ હોંગ-કોંગના ઠું ચુંનને પરાજય આપી બી.ડબલ્યુ.એફ. સુપર સીરીઝ ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાટરફાઇનલમાં જગ્યા બનાવી ચુક્યા છે.
- ૧૨) અમેરિકાના મહિલા ટેનીસ સ્ટાર વિનસ વિલિયમ્સે ઈંગ્લેન્ડના જહોન ક્વોન્ટાને પરાજય આપી માયામી ઓપન ટેનીસ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી ચુક્યા છે.
- ૧૩) હાલ ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા 422 પોઇન્ટના સર્વશ્રેષ્ઠ પોઇન્ટ સાથે વિશ્વના નંબર-ટુ ઓલ રાઉન્ડર બની ગયા છે.
- ૧૪) બ્રાજિલ દેશના પ્રખ્યાત ક્રૂટબોલર રોનાલ્ડીન્હોએ સંગીત ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય કરેલ છે.
- ૧૫) તુર્કીના લાંબા અંતરના રનર એલ્વાન એબેલેગેસી અને ગામ્બે બલુતને ડોપિંગમાં દોષિત જાહેર થવાને કારણે તેમની પાસેથી વર્ષ 2008 અને 2012 ઓલિમ્પિકના મેડલો પરત લેવામાં આવશે.

૧૬) ચેન્નાઈના નિવાસી શ્રીનાથ નારાયણન ભારતના 46 માં ગ્રાન્ડમાસ્ટર બનવા તૈયાર થયેલ છે.

૧૭) એશીયાઈ હોકી પુરસ્કારમાં ભારતના એસ.સુનીલ પ્લેયર ઓફ ધ યર બનેલા છે.

**અન્ય**

- ૧૮) સુનેના સિંહ નાલંદા વિશ્વ વિદ્યાલયના નવા કુલપતિ તરીકે નિયુક્તિ પામ્યા છે.
- ૧૯) હવેથી માઉન્ટ એવરેસ્ટના કલાઈમ્બર્સને શિખર પરથી કચરો નીચે લાવવા માટે પ્રતિ કિલો 120 રૂ. વળતર પ્રાપ્ત થશે.
- ૨૦) માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રવાતારોહી અને તેની સાથેના શેરપાઓને કેનવાસ બેગ ક્લીનઅપ મિશન સાથે જોડવામાં આવશે, તેના માટે 80 કિલો ક્ષમતા વાળી દસ કેનવાસ બેગ આપવામાં આવશે.

1-4- 2017

## સમીક્ષા 244 (1) તારીખ 1/4/2017

### દેશના રાષ્ટ્રપતિ અસમમાં નમામિ બ્રહ્મપુત્રનું ઉદ્ઘાટન કર્યું...

- ૧) ભારતનો સૌથી મોટો નદી તહેવાર નમામિ બ્રહ્મપુત્ર, અસમના 21 જિલ્લાઓમાં શરુ થયેલ છે.
- ૨) ભારતની એકમાત્ર પુરુષ નદીના રૂપમાં માનવામાં આવતી બ્રહ્મપુત્ર નદીના કિનારે આ કાર્યક્રમનું આયોજન થયેલ છે.
- ૩) ૩૧ માર્ચથી ૪ એપ્રિલ ૨૦૧૭ સુધી આ ઉત્સવ ચાલશે, તેમાં ૨૧ જિલ્લાઓના લોકો જોડાશે.
- ૪) આ તહેવારનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં રોકાણ વધારવા માટેનો છે.
- ૫) આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ભૂતાનના પ્રધાનમંત્રી હાજર રહ્યા હતા.
- ૬) આ કાર્યક્રમમાં અસમના રાજ્યપાલ બનવારીલાલ પણ પ્રમુખ પદ શોભાવશે.
- ૭) ભારતની તમામ નદીઓમાં બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષ નદીઓ દરજ્જો ધરાવે છે.

– પરેશ ચાવડા

1-4- 2017

રોજે- રોજ આપના ફોનમાં જી.કે, કરંટ અફેર્સ મેળવવા નીચેની લીંક પરથી એપ ડાઉનલોડ કરો.

<https://play.google.com/store/apps/details?id=com.edusafar>

કરંટ અફેર્સ તારીખ 22 થી 24 માર્ચ વિડીઓ જુઓ .

<https://www.youtube.com/watch?v=MmYEZaGGRKM>

વિજ્ઞાનની વિવિધ શાખાઓ ભાગ -4 એક મહત્વનો વિડીયો.

<https://www.youtube.com/watch?v=u3Eavx1IFoQ&t=84s>

ગુજરાતી વ્યાકરણ વિશેષણ-3 ગુજરાતી વિડીયો-25 નીચેની લિંક પરથી જુઓ.

<https://www.youtube.com/watch?v=XIv67y-iN2Q>

ઇંગ્લીશ ગ્રામર ઈન ગુજરાતી ભાગ-8 નીચેની લિંક પરથી જુઓ

<https://www.youtube.com/watch?v=9hgEIlCpeyo>

બેસ્ટ જુકે વિડીયો માટે નીચેની લીંક ઓપન કરો.

[https://www.youtube.com/channel/UCfDAM9P2RF\\_ynz8B\\_j5enC](https://www.youtube.com/channel/UCfDAM9P2RF_ynz8B_j5enC)

મિત્રો, એજ્યુસફર દ્વારા GK ના વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે આ માટે YouTube પર જઈ, EduSafar લખી સર્ચ કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરશો જેથી GK વિડીયો ના નવા અપડેટ્સ મેઈલ પર મળતારહેશે.